



નવસારી જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલ સારી કામગીરીની વિગત
સાફલ્યગાથા તા.૨૬/૧૦/૨૦૨૦ થી ૦૧/૧૧/૨૦૨૦

વિક દરમ્યાન કરેલ સારી કામગીરીની માસમાં નવસારી પોલીસે કરેલ સારી કામગીરી(સાફલ્યગાથા)ની વિગત.

કચેરી/ શાખા	કચેરી કામગીરીની વિગત	
નવસારી જિલ્લા એલ.સી.બી. પોલીસ	નવસારી જિલ્લા એલ.સી.બી. પોલીસ નાસતા ફરતા/ વોન્ટેડ આરોપીની તપાસમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે નવસારી રૂરલ પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં.૭૪૫/૨૦૧૮ પ્રોહી એક્ટ કલમ ૬૫એઈ, ૮૧, ૯૮(૨) મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી નજમુદ સાકિબ મોહંમદ આજમ ધોધાવાલા ,રહે ,ખજુરાવાડી, મોગલીસરા, સુરત નાઓને તેમના ધરેથી પકડી પાડી આરોપીને વધુ કાર્યવાહી અર્થે નવસારી રૂરલ પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.	
નવસારી જિલ્લા એલ.સી.બી. પોલીસ	નવસારી જિલ્લા એલ.સી.બી. પોલીસ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃત્તિ અટકાવવા પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે આરોપી (૧) મુકેશભાઈ રમેશભાઈ ચાવડા, (૨) વિશાલભાઈ રાજુભાઈ ઓડ, (૩) દિપેશભાઈ ઠાકોરભાઈ ઠંડેલ, (૪) રોહીતભાઈ રમેશભાઈ ઓડ, (૫) રવિભાઈ મુકેશભાઈ ચૌકસી નાઓને આરોપી મુકેશભાઈના ફ્લેટ નં. ૨૦૨, સૂર્યદર્શન એપાર્ટમેન્ટ દડંગવાડનો ટેકરો, કંસારવાડ નવસારીના માંથી ગંજીપાના તિનપત્તી હારજીતનો જુગાર રમાડી નાલ પેટે રૂ.૨૭૦૦/- તેમજ ચારે આરોપીઓની અંગઝડતી માંથી કુલ-૨૭૫૮૦/- તથા દાવ ઉપરના રોકડા રૂ.૨૭૫૦/- તથા મોબાઈલ નંગ-૪ કિ.રૂ.૧૭,૦૦૦/- મળી કુલ-૫૦,૦૩૦ મુદ્દમાલ સાથે પકડી પાડેલ છે.	

પોલીસ ફ્લેગ ડે- તારીખ ૨૧ થી ૩૧ ઓક્ટોબર દરમ્યાન વિવિધ કાર્યક્રમો ના આયોજન અંગે તારીખ ૨૫/૧૦/૨૦૨૦ ના રોજ નવસારી જિલ્લા પોલીસ દ્વારા Unity Run નું આયોજન કરવામાં આવેલ.



તા. ૨૫/૧૦/૨૦૨૦ ના રોજ પોલીસ હેડ ક્વાર્ટસ, નવસારી ખાતે પરંપરાગત રીતે શ્રી ઋષિકેશ ઉપાધ્યાય, પોલીસ અધિક્ષકશ્રી, નવસારી, પોલીસ અધિકારી/ કર્મચારીઓ દ્વારા પોલીસ વિભાગમાં વપરાતા વિવિધ શસ્ત્રોનું વિજયા દશમી નિમિત્તે પૂજન કરવામાં આવ્યું.



તા.૨૧/૧૦/૨૦૨૦મી ના રોજ નવસારી જિલ્લા પોલીસ અધિકારી/ કર્મચારીઓ દ્વારા એટુ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ સંભારણા દિનની ઉજવણી કરવામાં આવેલ.



તા.૨૧/૧૦/૨૦૨૦ ના રોજ નવસારી જિલ્લા પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, મહિલા સુરક્ષા સમિતિની બહેનો તથા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મરોલી પોલીસ સ્ટેશન વિસ્તારની મહિલાઓ તથા બાળકીઓમાં સાયબર ક્રાઇમ/સોશિયલ મિડીયા અંગે લોક જાગૃતિ આવે તે અંગે શ્રી ચિરાગભાઈ લાડ દ્વારા જાણકારી/સમજ આપવામાં આવેલ.



તા.૨૦/૧૦/૨૦૨૦ ના રોજ નવસારી જિલ્લા પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, મહિલા સુરક્ષા સમિતિની બહેનો તથા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વિજલપોર વિસ્તાર ની મહિલાઓ તથા બાળકીઓમાં સાયબર ક્રાઇમ અંગેની જાગૃતિ આવે તે માટે સાયબર અંગેના જાણકાર શ્રી ચિરાગભાઈ લાડ દ્વારા મહિલા જાગૃતિ અંગેની સમજ આપવામાં આવેલ.

